FINANCIAL EXPRESS

Submit affidavit or apologise: CEC to Rahul

DAMINI NATH New Delhi, August 17

ON THE DAY Leader of Opposition in the Lok Sabha Rahul Gandhi launched the "Voter Adhikar Yatra" in poll-bound Bihar accusing the Election Commission (EC) of "vote theft", Chief Election Commissioner Gyanesh Kumar on Sunday asked the Congress leader to either submit his allegations in a sworn affidavit within seven days or apologise to the nation.

In his first press conference since assuming office in February, Kumartermed recent allega-



Chief election commissioner (CEC) Gyanesh Kumar (fourth from left) with Election commissioners Sukhbir Singh Sandhu (third from left) and Vivek Joshi (extreme right) at a press conference, in New Delhi on Sunday

tions of discrepancies in the electoral roll made by Opposition leaders, particularly Gandhi's press conference on August 7, as "misinformation", saying that there was no evidence.

Gandhi had presented the findings of the Congress's sixmonth study of electoral rolls of Mahadevapura Assembly segment in Bangalore Central Lok Sabha seat in 2024, in which he said the party had found around 1 lakh allegedly fake voters. He said a similar template allegedly of fake addresses, duplicate entries etc — had been used across the country.

Although Kumar did not

mention Gandhi or Congress, he referred to those who made a "PPT" – a reference to Gandhi's presentation. He said there was no provision in law nor any evidence to issue notices to the over 1 lakh electors alleged to be fake. He said there was a difference between the electoral roll, where names could be repeated, and actually voting, and saying that those electors had voted multiple times was akin to labelling them "criminals". He said no valid electors' names would be cut without proof and that the Election Commission (EC) was standing like a "rock" with

NDA picks Maha Guv as VP candidate

THE RULING NATIONAL Democratic Alliance on Sunday named Maharashtra Governor Chandrapuram Ponnusamy Radhakrishnan, a seasoned BJP leader belonging to a key OBC caste from Tamil Nadu with an RSS background, as its vicepresidential candidate.

BJP president J P Nadda made the announcement following a meeting of the party's parliamentary board, which included Prime Minister Narendra Modi, and consultation with the party's allies. Nadda appealed for unanimous election of Radhakrishnan (67), an OBC leader and two-time former member of Lok Sabha from

Coimbatore, to the constitutional position, saying BJP leaders had spoken to the opposition parties over the last week and will reach out to them again.

Opposition leaders had told the BJP interlocutors that they can make up their mind only after being told of the ruling alliance's nominee, Nadda said, adding that his party will speak to them to reach a consensus over Radhakrishnan, whom he lauded as a "statesman".

In Radhakrishnan, the BJP has trusted a leader with a proven organsiational and ideological commitment, a far cry from its choice of his predecessor, Jagdeep Dhankhar. —PTI

FROM THE FRONT PAGE

Tech giants, startups eye governance mkt using AI

IN INDIA, FIRMS like cybersecurity advisory Inspira has launched a platform, designed to act as a control centre for enterprise AI. It lets companies see which AI models are in use, assess potential risks, and apply safeguards before harm is done.

Inspira is positioning itself to capture early market share with a subscription-based service that combines advisory, monitoring, and managed governance. "This includes preventing flawed decision-making, stopping sensitive information leaks, and ensuring compliance with emerging AI regulations and privacy laws," Chetan Jain, founding executive director and MD of Inspira said.

Priced starting at \$30,000 a month, the solution has found takers in West Asia where Inspira has a strong presence. It will follow a tiered pricing

model basis the quantum of data that needs to be fed into the platform. The platform can automatically discover all AI models running within a company's cloud and on-premise systems—including unapproved"shadow"AI tools.It evaluates each model's risk profile by considering data sensitivity, user access, and exposure to

threats such as prompt injection

or inaccurate outputs. Initial targets include banks, insurers & healthcare providers in India, the US, and West Asia, where AI adoption is rapid and data sensitivity high. By bringing AI oversight into the enterprise workflow, Inspira aims to give firms the confidence to innovate without losing control of their powerful new tools.

Recognising the potential to scale up, the firm will look to other markets in the future. In

an effort towards casting a global net, the platform also aligns model use with regulatoryframeworkslike ISO 42001 (the international standard for Artificial Intelligence Management Systems) and the EU AI Act, while offering real-time controls to block or log risky activities.

The firm has already gone to market with the platform, and is working with internal audit teams at various enterprises as part of the pilot. "The audit teams are not equipped to deal with AI in enterprises currently, and AI Governance platform is helping address this shortfall," Jain explained. The scale, however, will come with maturity as more companies adopt not only AI, but compliance measures to ensure ethical and secure use of the technology in their operations.

RBI considers reducing risk weights for auto loans

SENIOR RBI OFFICIALS indicated that while some banks have begun aligning with the reporate cuts — particularly in the auto loan segment — it may take a couple more months for broader transmission to play out.

According to the latest lending-deposit rates data from the RBI, the weighted average lending rate on fresh rupee loans fell 78 basis points between February - when the RBI began slashing repo rates — and June. The lending rates of public sector banks fell by 86 bps while the decline was 50 bps for private sector banks.

Last month, FADA had written to the RBI saying that the auto retail sector is going through a tough phase and there has been a significant rise

in inventory. It also requested the central bank to conduct a review of the transmission of the repo rate cut in auto loans and ensure that private banks comply with the same speed of transmission as PSBs.

According to data, there was

an estimated net addition of 15,000-18,000 units in June to the overall inventory of around 600,000 units. While wholesales (manufacturers to dealers) in June were estimated around 315,000-318,000, the retail segment (dealers to customers) stood at 297,722 units. This translated into an inventory of around 55 days.

The automotive dealers' body also urged the RBI to issue clear guidelines to banks to ensure uniform application of MSME lending benefits to eligi-

ble auto-retail businesses, alleging that in several instances, banks have not extended preferential interest rates to MSMEregistered dealerships, although auto workshops, service centres and smaller dealerships are eligible for MSME registration under the Udyam framework.

The association has sought extension of the Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises to the autoretail channel, saying at present, authorised dealerships and workshops remain outside its ambit.

Currently the private sector banks such as HDFC Bank and ICICI Bank provide auto loans at over 9%, while Bank of Baroda and Punjab National Bank provide loans in the range of 8%.

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA. INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE SME PLATFORM OF BSE LIMITED ("BSE SME") IN COMPLIANCE WITH CHAPTER IX OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018 AS AMENDED ("SEBI ICDR REGULATIONS")

every elector.

PUBLIC ANNOUNCEMENT





GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED

Our Company was originally incorporated as a Private Limited Company in the name of "Gujarat Peanut Products Private Limited" on October 14, 2005 under the provisions of Companies Act, 1956 bearing Corporate Identification Number U15490GJ2005PTC046918 issued by Registrar of Companies – Gujarat, Dadra and Nagar Haveli. Subsequently, our company was converted into Public Limited Company under the Companies Act, 2013 and the name of our Company was changed to "Gujarat Peanut Products Limited" vide a fresh Certificate of Incorporation consequent upon conversion from Private Company to Public Company dated June 26, 2024 bearing Corporate Identification Number U15490GJ2005PLC046918 issued by Registrar of Companies - Gujarat. The name of our Company was further changed to "Gujarat Peanut and Agri Products Limited" vide a fresh Certificate of Incorporation dated Novembe 12, 2024 issued by the Registrar of Companies, Central Processing Centre. For further details of change in name and registered office of our company, please refer to section titled "Our History and Certain Corporate Matters" beginning on page no 139 of the Draft Prospectus.

> Registered Office: D - 402, Imperial Heights, Opp. Big Bazar, 150 Feet Ring Road, Rajkot, Gujarat, India, 360005 Contact Person: Mr. Jeetkumar B. Raychura, Company Secretary & Compliance Officer; Tel No: +91 98258 03208; E-Mail ID: cs@gujaratpeanut.com; Website: www.gujaratpeanut.com; CIN: U15490GJ2005PLC046918

OUR PROMOTERS: (I) MR. ARUNKUMAR NATVARLAL CHAG, (II) MR. SAGAR ARUNKUMAR CHAG AND (III) MRS. DHRUVA SAGAR CHAG

INITIAL PUBLIC OFFER OF 29,76,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH ("EQUITY SHARES") OF GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, INCLUDING A SHARE PREMIUM OF ₹70/- PER EQUITY SHARE (THE "ISSUE PRICE"), AGGREGATING TO ₹ 2,380.80 LAKHS ("THE ISSUE"), OF WHICH 1,48,800 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 119.04 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTIONS BY THE MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS MARKET MAKER RESERVATION PORTION I.E. ISSUE OF 28,27,200 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 2,261.76 LAKHS IS HERE IN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 29.00% AND 27.55% RESPECTIVELY OF THE POST ISSUE PAIDUP EQUITY SHARE CAPITAL OF THE COMPANY.

THE FACE VALUE OF THE EQUITY SHARE IS ₹ 10/- EACH. THE OFFER PRICE IS 8.0 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES.

THIS OFFER IS BEING MADE IN TERMS OF CHAPTER IX OF THE SEBI (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIRMENT) REGULATIONS, 2018 (THE "SEBI ICDR REGULATIONS") READ WITH RULE 19(2)(b)(i) OF SCRR AS AMENDED. THIS ISSUE IS A FIXED PRICE ISSUE AND ALLOCATION IN THE NET OFFER TO THE PUBLIC WILL BE MADE IN TERMS OF REGULATION 253(2) OF THE SEBI (ICDR) REGULATIONS, 2018. (For further details please see "The Issue" beginning on page no. 46 of the Draft Prospectus.) A copy will be delivered for filing to the Registrar of Companies as required under sub-section 4 of Section 26 of the Companies Act, 2013.

In terms of Regulation 256 of SEBI ICDR Regulations read with the SEBI Circular No. CIR/CFD/POLICYCELL/11/2015 dated November 10, 2015, and Unified Payments Interface (UPI) introduced vide SEBI Circular Ref: SEBI/HO/CFD/DIL2/CIR/P/2018/138 dated November 1, 2018 all the potential investors shall participate in the issue only through an Application Supported by Blocked Amount ("ASBA") process providing details about the bank account which will be blocked by the Self Certified Syndicate Banks ("SCSBs") for the same. Further, pursuant to SEBI Circular No. SEBI/HO/CFD/DCR2/CIR/P/2019/133 dated November 08, 2019, Individual Investors applying in public issue may use either Application Supported by Blocked Amount (ASBA) process or UPI payment mechanism by providing UPI ID in the Application Form which is linked from Bank Account of the investor. (For details in this regard, specific attention is invited to "Issue Procedure" beginning on page no. 261 of the Draft Prospectus.)

This public announcement is being made in compliance with the provisions of Regulation 247(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares pursuant to the Offer and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited (BSE SME). Pursuant to Regulation 247(1) of the SEBI ICDR Regulations, the Draft Prospectus filed with BSE SME shall be made public for comments, if any, for a period of at least 21 days, from the date of such filing by hosting it on the website of BSE SME at www.bseindia.com, on the website of the Company at www.gujaratpeanut.com and on the website of the Lead Manager, i.e. Finshore Management Services Limited at www.finshoregroup.com. Our Company invites members of the public to give their comments on the Draft Prospectus filed with BSE SME, with respect to disclosures made in the Draft Prospectus. The members of the public are requested to send a copy of their comments to BSE and/or to the Company Secretary and Compliance Officer of our Company on email id: cs@gujaratpeanut.com and/or the Lead Manager on email id: investors@finshoregroup.com within 21 days from the aforesaid date of filing of the Draft Prospectus with BSE SME.

Investments in Equity and Equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Equity Shares issued in the Issue have not been recommended or approved by the Securities and Exchange Board of India ("SEBI"), nor does SEBI guarantee the accuracy or adequacy of the Draft Prospectus. Specific attention of the investors is invited to the section "Risk Factors" beginning on page 22 of the Draft Prospectus.

Any decision to invest in the Equity Shares described in the Draft Prospectus may only be taken after the Prospectus has been filed with the RoC and must be made solely on the basis of such Prospectus as there may be material changes in the Prospectus from the Draft Prospectus. The Equity Shares, when offered through the Prospectus, are proposed to be listed on the SME Platform of BSE Limited ("BSE SME").

For details of the share capital and capital structure and the names of the Signatories to the Memorandum of Association and the number of shares subscribed by them of our Company, please see the section titled "Capital Structure" beginning on page 59 of the Draft Prospectus. The liability of members of our Company is

For details of the main objects of our Company as contained in the Memorandum of Association, please see the section titled "History and Certain Corporate Matters" beginning on page 139 of the Draft Prospectus.

As the rhythm of looms withers away, an uneasy silence sets in

industry. For instance, the making of a single T-shirt can involve eight or more stages spinning, knitting, dyeing, finishing, sewing, labelling and packaging — plus value-added processes like printing and embroidery, often handled by separate specialist units. "When orders stop, every link in that chain is hit," said N Thirukkumaran, general secretary of TEA.

Some exporters, he notes, have 100% exposure to the US, others 80% or slightly less, "but a 50% tariff is crippling across the board." If the issue isn't resolved in the next few weeks, layoffs and even unit closures are inevitable, he warns, since 95% of Tiruppur's units are SMEs without the reserves to absorb such shocks.

Thirukkumaran's firm, Esstee Exports, however, is a custom manufacturer of highend fashion for men, women and children, with less than 10% exposure to the US and 90% to Europe. But for players Tiruppur's volumes lost to the US market, everyone — from the biggest exporters to the smallest units — is competing for the same buyers in Europe and the UK.

However, the US market's pull is hard to replace. On average, a US household spends \$1,500-2,000 a year on clothing and footwear, buying around 68 pieces annually. India supplies about 8% of that — roughly six to seven items per American per year. "That's the sheer size of demand we're talking about," Duraiswamy says, adding that factories built for the scale of US orders can't simply retool for Europe's smaller, more sea-

sonal demand. Industry players are now urging the Indian government to step in. They want Covid-era relief measures such as loan moratoriums, extending the NPA classification period to 180 days from 90, and reinstating the interest equalisation scheme

THE SHOCK IS amplified by like him, there is a different scrapped in December. They the cluster-based nature of the kind of challenge. With half of also seek the removal of the ₹50 lakh threshold on packing credit and stress that rating agencies must factor in the current crisis.

> Thirukkumaran believes the longer-term solution lies in speeding up free trade agreements with the European Union (EU) and Gulf Cooperation Council (GCC) nations. "Nearly 30% of India's apparel exports already go to Europe and 10% to the UK. With an EU FTA, that 40% could grow significantly, reducing our dependence on the US over time," he said.

> For Woodrose Apparel's Kumar, the future has come full circle. Just months ago, he was preparing to reduce his reliance on Europe and the UK from 100% to 70%, betting on the US to take up the remaining 30%. Now, with his American dream on hold, he is back to chasing orders in the very markets he once planned to scale down — hoping they can keep his looms running until better days return.

REGISTRAR TO THE ISSUE



INTEGRATED REGISTRY MANAGEMENT SERVICES (P) LIMITED Address: No 30, Ramana Residency-4th Cross,

Sampige Road, Malleswaram, Bengaluru - 560003 **Telephone:** 080-23460815/816/817/818; Fax: 080-23460819 **E-mail:** smeipo@integratedindia.in Contact Person: Mr. S Giridhar

Website: www.integratedregistry.in

Investor Grievance Email: giri@integratedindia.in SEBI Registration No: INR000000544 CIN No: U74900TN2015PTC101466

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed in the Draft prospectus.

For GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED On behalf of the Board of Directors

> Sagar Arunkumar Chag **Managing Director**


> DIN: 02192020

Ahmedabad

GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED is proposing, subject to the receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited ("BSE SME") The Draft Prospectus is available on the websites of the BSE SME at www.bseindia.com, the website of the Company at www.gujaratpeanut.com and the website of the Lead Manager, i.e., Finshore Management Services Limited at www.finshoregroup.com. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section titled 'Risk Factors" on page 22 of the Draft Prospectus. Potential investors should not rely on the Draft Prospectus filed with BSE SME for making any investment decision.

This announcement has been prepared for publication in India and not to be released or distributed in the United States. This announcement is not an offer to sell or a solicitation of any offer to buy Equity Shares of our Company in any jurisdiction, including the United States. The Equity Shares have not been, and will not be, registered under the U.S. Securities Act 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States and may not be Issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in Regulation S under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act. Accordingly, the Equity Shares will be Issued and sold outside the United States in compliance with Regulation S of the Securities Act and the applicable laws of the jurisdiction where those Issues and sales occur. The Equity Shares have not been, and will not be, registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be Issued or sold, and applications may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.





LEAD MANAGER TO THE ISSUE

FINSHORE

Email: info@finshoregroup.com

Website: www.finshoregroup.com

SEBI Registration No: INM000012185

CIN No: U74900WB2011PLC169377

Place: Rajkot, Gujarat

Date: 16/08/2025

Creating Enterprise Managing Values

Telephone: 033 – 2289 5101 / 4603 2561

Contact Person: Mr. S. Ramakrishna Iyengar

FINSHORE MANAGEMENT SERVICES LIMITED

Anandlok Building, Block-A, 2nd Floor, Room No. 207,

227 A.J.C Bose Road, Kolkata-700020, West Bengal, India

Investor Grievance Email: investors@finshoregroup.com

स्थान : दिल्ली, दिनांक : 17.05.2025

पंजी. कार्यालय :− प्लॉट−15, छठा तल, सेक्टर−44, इंस्टीट्यूशनल एरिया, गुरूग्राम, हरियाणा−122 002, कब्जा सूचना शाखा कार्यालय : 30, पारक कालोनी, स्टेशन रोड, मंदसौर, मध्य प्रदेश –458 002 कॉन्टैक्ट :– 6260203202 जबिक, अधोहस्ताक्षरी ने इंडिया शेल्टर फाइनैंस ऐंड कॉर्पोरेशन लिमिटेड के प्राधिकृत अधिकारी के रूप में, वित्तीय आस्तियों का प्रतिभृतिकरण एवं पुनरनिर्माण और (प्रतिभूति) हित (प्रवर्तन) अधिनियम, 2002 के अधीन और प्रतिभूति हित (प्रवर्तन) नियमावली, 2002 के नियम 3 के साथ पिटत धारा 13(12) के अधीन प्रदत्त शक्तियों का प्रयोग करते हुए एक मांग सूचना इसमें आगे वर्णित खाते के सामने वर्णित तिथि को जारी की थी, जिसमें कर्जदार और सम्पत्ति के स्वामी / प्रतिभु से बकाया राशि का भुगतान उक्त सुचना की तिथि से 60 दिन के भीतर करने की मांग की गई थी। जबकि सम्पत्ति स्वामी और अन्य उक्त बकाया राशि चुकाने में असफल रहे हैं, एतदद्वारा अधोवर्णित कर्जदारों तथा सर्वसाधारण को सूचना दी जाती है कि अधोहस्ताक्षरी ने यहां नीचे वर्णित सम्पत्ति / यों का कब्जा उक्त नियमावली के नियम 8 एवं 9 के साथ पठित उक्त अधिनियम की धारा 13(4) के अधीन उसको प्रदत्त शक्तियों का प्रयोग करते हुए प्रत्येक खाते के सामने वर्णित तिथि को प्राप्त कर लिया है। अब, कर्जदार को विशेष रूप से तथा सर्वसाधारण को इन सम्पत्ति / यों के संबंध में संव्यवहार नहीं करने हेत सावधान किया जाता है तथा इन सम्पत्ति / यों के संबंध में कोई भी संव्यवहार इंडिया शेल्टर फाइनैंस कार्पोरेशन लिमिटेड की

इंडिया शेल्टर फाइनैंस कार्पोरेशन लिभिटेड

-IndiaShelter

नीचे वर्णित बकाया राशि तथा उस पर ब्याज, लागत इत्यादि के प्रभाराधीन होगा।

कर्जदार / गारंटर	प्रभारित / बंधक सम्पत्ति	मांग सूचना की तिथि,	कब्जा	
(सम्पत्ति स्वामी)	(सम्पत्ति के सभी	मांग सूचना की तिथि तक	की तिथि	
का नाम एवं ऋण खाता नंबर	अंश एवं खंड) का वर्णन	बकाया राशि		
श्री / श्रीमती स्मिता ठाकुर,	सम्पत्ति के सभी अंश एवं खंड : सम्पत्ति प्लॉट नंबर सी-14	मांग सूचना ०९-०८-२०२१	13-08-2025	
श्री / श्रीमती प्रमोद राव	तथा सी–15 का भाग, देव नगर कालोनी, प्रतापगढ़, जिला	₹5. 9,14,162.52 / -	सांकेतिक कब्जा	
मकान नंबर 2/28,	प्रतापगढ़ आरजे 312 605 पूरब : कालोनी रोड 30 फीट,	(रूपए नौ लाख चौदह हजार एक		
हाउसिंग बोर्ड कालोनी, प्रतापगढ़,	पश्चिम : प्लॉट नंबर सी-5 तथा सी-6, उत्तर : प्लॉट नंबर	सौ बासट तथा पैसे बावन मात्र) 31	-08-2021	
जिला प्रतापगढ़ आरजे 312 605,	सी—14 का बाकी भाग, दक्षिण : प्लॉट नंबर सी—15 का भाग	तक बकाया + 01-09-2021 से भु	गतान	
ऋण खाता सं : HL45CHLONS0000	की तिथि तक ब्याज और अन्य प्रभार एवं लागत			
श्रीमान / श्रीमती सुरेया बी	सम्पत्ति के सभी अंश एवं खंड : प्लॉट संख्या सी-8 का	मांग सूचना 20-06-2022	13-08-2025	
श्रीमान / श्रीमती जैनुद्दीन	भाग, भूमि सर्वेक्षण संख्या 1246 वाटर वर्क्स रोड, प्रतापगढ़			
श्रीमान / श्रीमती शाबाजुद्दीन	जिला प्रतापगढ़ आरजे 312605, सीमाः –, पूर्वः – सी–07,	पिचासी हजार सात सौ बीस तथा		
पता : वार्ड 23, अमन नगर वाटर	पश्चिमः – प्लॉट संख्या सी–09, उत्तरः – कॉलोनी रोड			
वर्क्स रोड, प्रतापगढ–312605 राजस्थान		बकाया + 17—06—2022 से भुगतान		
ऋण खाता संख्या LA45LLONS000005003194 तिथि तक ब्याज और अन्य प्रभार एवं लागत				
स्थान : राजस्थान, तिथि : 18–08–2025 वास्ते इंडिया शेल्टर फाइनैंस कार्पोरेशन लिमिटेड (प्राधिकृत अधिकारी)				
किसी पूछताछ के लिए प्राधिकृत अधिकारी से सम्पर्क करें :				

श्री गौरव सरैया (73891 48935). श्री संजय राठौर (+91 9993460061)

UNIMONI FINANCIAL SERVICES LIMITED

RO: N.G. 12 & 13 Ground Floor, North Block, Manipal Centre, Dickenson Road, Bangalore - 560 042. CIN No. U85110KA1995PLC018175

PUBLIC NOTICE यह जनता को सूचित करने के लिए है कि गिरवी रखे गए सोने के आभूषणों की नीलामी UNIMONI FINANCIAL SERVICES LIMITED द्वारा 21.08.2025 को सुबह 10:00 बजे नीचे दिए गए संबंधित केंद्रों पर की जाएगी। नीलाम किए जाने वाले सोने के आभूषण हमारे विभिन्न ग्राहकों के ऋण खातों से संबंधित हैं. जो अपना बकाया चकाने में विफल रहे हैं। नीलामी के हमारे नोटिस इन उधारकर्ताओं को विधिवत जारी किए गए हैं। नीलाम किए जाने वाले सोने के आभूषण हमारे विभिन्न ग्राहकों के अतिदेय ऋण खातों से संबंधित हैं. जिनका उल्लेख शाखा के नाम के साथ किया गया है।

Auction Centre Address & Loan Nos: BALLIA (BIA-Building No 15, Panni Tanki Road, before Church Cutra, Ballia -277001, Contact no: 9305006705) 2167222, 2131173, 2167256, 2167303, 2132508, 2109436, BASTI (BTI - First Floor 91, Rama Niwas, Maliviya Road, Above IDBI Bank, Gandhinagar, Basti -272001, Contact no: 9305546358) 2116030, 2172137. DEORIA (DEO - KAILASH MANDAP. NEXT TO 0 B C, GORAKHPUR ROAD - 274001, Contact no.9935305599) 2134261. 2151644, 2169592, 2109370, 2131805, 2147626, GONDA (GDA - Modi Heights, Station Road, 1St Floor, 199+202/178, Gonda -271002, Contact No. 9839906446) 2135319, 2124294, 2128895. KASIA (KSA - No 124, Main Road Gola Bazarkasia, Kushinagar, Kasia -274402, Contact no : 9305020600) 2135163, 2115799, 2152181, 2131366, 2168292, 2111764, 2186870, 2174928, 2146040. LUCKNOW(LUK - G Floor, 44 A Cantt Roadlucknowuttar Pradesh -226001, Contact No.9935383311) 2199252. UNNAO (UNN - Building No 2, Babugani, Unnao -209801, Contact no : 9307616727) 2152359, 2135236, 2167199, 2111053, 2113404, 2114913, 2128039, 2186779, 2161162.

(Reserves the right to alter the number of accounts to be auctioned &/ postpone / cancel the auction without any prior notice)

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA. INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE SME PLATFORM OF BSE LIMITED ("BSE SME") IN COMPLIANCE WITH CHAPTER IX OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS").

अचल सम्पत्ति के लिए

PUBLIC ANNOUNCEMENT





GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED

Our Company was originally incorporated as a Private Limited Company in the name of "Gujarat Peanut Products Private Limited" on October 14, 2005 under the provisions of Companies Act, 1956 bearing Corporate Identification Number U15490GJ2005PTC046918 issued by Registrar of Companies - Gujarat, Dadra and Nagar Haveli. Subsequently, our company was converted into Public Limited Company under the Companies Act, 2013 and the name of our Company was changed to "Gujarat Peanut Products Limited" vide a fresh Certificate of Incorporation consequent upon conversion from Private Company to Public Company dated June 26, 2024 bearing Corporate Identification Number U15490GJ2005PLC046918 issued by Registrar of Companies - Gujarat. The name of our Company was further changed to "Gujarat Peanut and Agri Products Limited" vide a fresh Certificate of Incorporation dated November 12, 2024 issued by the Registrar of Companies, Central Processing Centre. For further details of change in name and registered office of our company, please refer to section titled "Our History and Certain Corporate Matters" beginning on page no 139 of the Draft Prospectus.

> Registered Office: D - 402, Imperial Heights, Opp. Big Bazar, 150 Feet Ring Road, Rajkot, Gujarat, India, 360005 Contact Person: Mr. Jeetkumar B. Raychura, Company Secretary & Compliance Officer; Tel No: +91 98258 03208 E-Mail ID: cs@qujaratpeanut.com; Website: www.qujaratpeanut.com; CIN: U15490GJ2005PLC046918

OUR PROMOTERS: (I) MR. ARUNKUMAR NATVARLAL CHAG, (II) MR. SAGAR ARUNKUMAR CHAG AND (III) MRS. DHRUVA SAGAR CHAG

INITIAL PUBLIC OFFER OF 29,76,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH ("EQUITY SHARES") OF GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, INCLUDING A SHARE PREMIUM OF ₹70/- PER EQUITY SHARE (THE "ISSUE PRICE"), AGGREGATING TO ₹ 2,380.80 LAKHS ("THE ISSUE"), OF WHICH 1,48,800 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 119.04 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTIONS BY THE MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS MARKET MAKER RESERVATION PORTION I.E. ISSUE OF 28,27,200 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 2,261.76 LAKHS IS HERE IN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 29.00% AND 27.55% RESPECTIVELY OF THE POST ISSUE PAIDUP EQUITY SHARE CAPITAL OF THE COMPANY.

THE FACE VALUE OF THE EQUITY SHARE IS ₹ 10/- EACH. THE OFFER PRICE IS 8.0 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES.

THIS OFFER IS BEING MADE IN TERMS OF CHAPTER IX OF THE SEBI (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIRMENT) REGULATIONS, 2018 (THE "SEBI ICDR REGULATIONS") READ WITH RULE 19(2)(b)(i) OF SCRR AS AMENDED. THIS ISSUE IS A FIXED PRICE ISSUE AND ALLOCATION IN THE NET OFFER TO THE PUBLIC WILL BE MADE IN TERMS OF REGULATION 253(2) OF THE SEBI (ICDR) REGULATIONS, 2018. (For further details please see "The Issue" beginning on page no. 46 of the Draft Prospectus.) A copy will be delivered for filing to the Registrar of Companies as required under sub-section 4 of Section 26 of the Companies Act, 2013.

In terms of Regulation 256 of SEBI ICDR Regulations read with the SEBI Circular No. CIR/CFD/POLICYCELL/11/2015 dated November 10, 2015, and Unified Payments Interface (UPI) introduced vide SEBI Circular Ref: SEBI/HO/CFD/DIL2/CIR/P/2018/138 dated November 1, 2018 all the potential investors shall participate in the issue only through an Application Supported by Blocked Amount ("ASBA") process providing details about the bank account which will be blocked by the Self Certified Syndicate Banks ("SCSBs") for the same. Further, pursuant to SEBI Circular No. SEBI/HO/CFD/DCR2/CIR/P/2019/133 dated November 08, 2019, Individual Investors applying in public issue may use either Application Supported by Blocked Amount (ASBA) process or UPI payment mechanism by providing UPI ID in the Application Form which is linked from Bank Account of the investor. (For details in this regard, specific attention is invited to "Issue Procedure" beginning on page no. 261 of the Draft Prospectus.)

This public announcement is being made in compliance with the provisions of Regulation 247(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares pursuant to the Offer and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited (BSE SME). Pursuant to Regulation 247(1) of the SEBI ICDR Regulations, the Draft Prospectus filed with BSE SME shall be made public for comments, if any, for a period of at least 21 days, from the date of such filing by hosting it on the website of BSE SME at www.bseindia.com, on the website of the Company at www.gujaratpeanut.com and on the website of the Lead Manager, i.e. Finshore Management Services Limited at www.finshoregroup.com. Our Company invites members of the public to give their comments on the Draft Prospectus filed with BSE SME, with respect to disclosures made in the Draft Prospectus. The members of the public are requested to send a copy of their comments to BSE and/or to the Company Secretary and Compliance Officer of our Company on email id: cs@gujaratpeanut.com and/or the Lead Manager on email id: investors@finshoregroup.com within 21 days from the aforesaid date of filing of the Draft Prospectus with BSE SME.

Investments in Equity and Equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Equity Shares issued in the Issue have not been recommended or approved by the Securities and Exchange Board of India ("SEBI"), nor does SEBI guarantee the accuracy or adequacy of the Draft Prospectus. Specific attention of the investors is invited to the section "Risk Factors" beginning on page 22 of the Draft Prospectus.

Any decision to invest in the Equity Shares described in the Draft Prospectus may only be taken after the Prospectus has been filed with the RoC and must be made solely on the basis of such Prospectus as there may be material changes in the Prospectus from the Draft Prospectus. The Equity Shares, when offered through the Prospectus, are proposed to be listed on the SME Platform of BSE Limited ("BSE SME").

For details of the share capital and capital structure and the names of the Signatories to the Memorandum of Association and the number of shares subscribed by them of our Company, please see the section titled "Capital Structure" beginning on page 59 of the Draft Prospectus. The liability of members of our Company is limited.

For details of the main objects of our Company as contained in the Memorandum of Association, please see the section titled "History and Certain Corporate Matters" beginning on page 139 of the Draft Prospectus.

LEAD MANAGER TO THE ISSUE FINSHORE

Creating Anterprise Managing Values FINSHORE MANAGEMENT SERVICES LIMITED

Telephone: 033 – 2289 5101 / 4603 2561 Email: info@finshoregroup.com Contact Person: Mr. S. Ramakrishna Iyengar

227 A.J.C Bose Road, Kolkata-700020, West Bengal, India

Anandlok Building, Block-A, 2nd Floor, Room No. 207,

Website: www.finshoregroup.com Investor Grievance Email: investors@finshoregroup.com

SEBI Registration No: INM000012185 CIN No: U74900WB2011PLC169377 All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed in the Draft prospectus.

Place: Rajkot, Gujarat

Date: 16/08/2025

REGISTRAR TO THE ISSUE Integrated

INTEGRATED REGISTRY MANAGEMENT SERVICES (P) LIMITED Address: No 30, Ramana Residency-4th Cross,

Sampige Road, Malleswaram, Bengaluru - 560003 **Telephone:** 080-23460815/816/817/818; Fax: 080-23460819 **E-mail:** smeipo@integratedindia.in

Contact Person: Mr. S Giridhar Website: www.integratedregistry.in Investor Grievance Email: giri@integratedindia.in SEBI Registration No: INR000000544

CIN No: U74900TN2015PTC101466

For GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED

On behalf of the Board of Directors

Sagar Arunkumar Chag **Managing Director** DIN: 02192020

GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED is proposing, subject to the receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited ("BSE SME"). The Draft Prospectus is available on the websites of the BSE SME at www.bseindia.com, the website of the Company at www.gujaratpeanut.com and the website of the Lead Manager, i.e., Finshore Management Services Limited at www.finshoregroup.com. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section titled 'Risk Factors" on page 22 of the Draft Prospectus.

Potential investors should not rely on the Draft Prospectus filed with BSE SME for making any investment decision. This announcement has been prepared for publication in India and not to be released or distributed in the United States. This announcement is not an offer to sell or a solicitation of any offer to buy Equity Shares of our Company in any jurisdiction, including the United States. The Equity Shares have not been, and will not be, registered under the U.S. Securities Act 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States and may not be Issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in Regulation S under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act. Accordingly, the Equity Shares will be Issued and sold outside the United States in compliance with Regulation S of the Securities Act and the applicable laws of the jurisdiction where those Issues and sales occur. The Equity Shares have not been, and will not be, registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be Issued or sold, and applications may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.

'IMPORTANT'

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or

manner whatsoever.

damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any

कब्जा सूचना (अचल संपत्ति के लिए) नियम 8-(1) जैसाकि. वित्तीय परिसंपत्तियों के प्रतिभृतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभृति हित प्रवर्तन अधिनियम, 2002 के अंतर्गत आईआईएफएल ह फाइनेंस लिमिटेड (पहले इंडिया इंफोलाइन हाउसिंग फाइनेंस लिमिटेड के रूप में विदित) (आईआईएफएल) के अधिकृत अधिकारी के रूप में और प्रतिभृति हित (प्रवर्तन) नियम 2002 के नियम 3 के साथ पठित धारा 13(12) द्वारा प्रदत्त शक्तियों का उपयोग करते हुए, हस्ताक्षरकत ने मांग सुचना जारी कर उधारकताओं नीचे दिए गए बकाया राशि के भृगतान का निर्देश दिया गया था। उधारकर्ता भृगतान करने में विफल रहे, अतः एतदद्वारा उधारकर्ता तथा आम जनता को सुचित किया जाता है कि उक्त नियम की धारा 13(4) के तहत प्रदत्त शक्तियों का उपयोग करते हुए, हस्ताक्षरकर्ता ने नीचे वर्णित संपत्ति का कब्जा कर लिया है। एतदद्वारा उधारकताओं और आम जनता को सतर्क किया जाता है कि वे संपत्ति के साथ किसी भी प्रकार का लेन–देन न करें तथा संपत्ति के साथ किसी भी प्रकार का लेन–देन नीचे उल्लिखित राशि और उस पर ब्याज के लिए आईआईएफएल-एचएफएल के प्रभार के अधीन होगा। उधारकताओं का ध्यान अधिनियम की धारा 13 के उप-धारा (8) के प्रावधानों की ओर आकर्षित किया जाता है कि यदि उधारकर्ता संपत्ति की बिक्री या हस्तानांतरण की तारीख से पहले "आईआईएफएल-एचएफएल" के बकाया राशि को सभी लागत, शुल्क और खर्च के साथ भगतान करते हैं. तो "आईआईएफएल-एचएफएल" द्वारा संपत्ति की बिक्री नहीं की

उधारकर्ता∕ सह-उधारकर्ता	ो कोई कदम उठाया जाएगा। गिरवी संपत्ति (अचल संपत्ति) का विवरण	कुल बकाया राशि (रु.)	मांग सूचना	कब्जा लेने	
का नाम श्री पूरन लाल श्रीमती शकुंतला प्रॉस्पेक्ट नंबरः IL10218272	फ्लैट नंबर एसएफ-4, एम.आई.जी, दूसरी मंजिल, छत के अधिकारों के बिना, पिछला आरएचएस, प्लॉट नं. ए-10/3, ब्लॉक ए, डीआईएफ अंकुर विहार, ग्राम लोनी परगना, तहसील लोनी, जिला गाजियाबाद, यूपी, 201102। बिक्री योग्य क्षेत्र, कालीन क्षेत्र, भूमि क्षेत्र (वर्ग फुट में): संपत्ति का प्रकारः निर्मित क्षेत्र संपत्ति क्षेत्रः 563.00, 446.00, 494.00	रु. 1779679/- (रुपये सत्रह लाख उन्यासी हजार छह सौ उन्यासी मात्र)	की तिथि 29-05- 2025	की तिथि 12/08 /25	
अधिक विवरण के लिए, कृपया अधिकृत अधिकारी से शाखा कार्यालय ः ए-1सी और ए-1डी, दूसरी मंजिल, नोएडा सेक्टर 16, नोएडा, गौतम बुद्ध नगर –					

हस्ता/- अधिकृत अधिकारी, आईआईएफएल होम फाइनेंस लिमिटेड की ओर रं

SER INDUSTRIES LIMITED

Corporate Identification Number: L60231KA1963PLC004604; Registered Office: Chikkakuntanahali Vilagebidadi Hobli Ramnagaram Taluk, Bangalore - 562109, Karnataka, India: Contact Number: +91-9343702920/ +91-80-27204463:

Email Address: info@serindustries.co.in; Website: www.serindustries.co.in;

201301 या कॉपोरेंट कार्यालय : आईआईएफएल टावर, प्लॉट नं. 98, उद्योग विहार, फेज-IV, गुरुग्राम, हरियाणा में संपर्क करें।

Recommendations of the Committee of Independent Directors ("IDC") of M/s SER Industries Limited ('Target Company') in relation to the Open Offer ('Offer') made by Mr. Sunil Kumar Shahi (Acquirer), to the Public Shareholders of the Target Company under the provisions of Regulation 26(7) of SEBI (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and Subsequent Amendments thereto ('SEBI (SAST) Regulations').

Date	Thursday, August 14, 2025		
Name of the Target Company	SER Industries Limited		
Details of the Offer pertaining to the Target Company	Open offer being made by the Acquirer for acquisition of up to 2,57,294 Offer Shares, representing 26.00% of the Voting Share Capital of the Target Company, at a price of ₹35.00/- per Offer Share, payable in cash, assuming full acceptance aggregating to a maximum consideration of ₹90,05,290.00/- payable in cash.		
Names of the Acquirer and Persons	Mr. Sunit Kumar Shahi (Acquirer)		
Acting in Concert with the Acquirer	There is no person acting in concert for this Offer		
Name of the Manager to the offer	Swaraj Shares	and Securities Private Limited	10
Members of the Committee of	Sr. No.	Name of the Independent Directors	Designation
Independent Directors (IDC)	1.	Mr. Om Narayan Singh	Chairman
	2.	Ms. Aarti Jeetendra Juneja	Member
IDC Member's relationship with the Target Company (Director, Equity shares owned, any other contract/ relationship), if any	All IDC Members are Independent Directors on the Board of the Target Company. IDC Members have not entered into any other contract or have other relationships with the Target Company.		
Trading in the Equity Shares/other securities of the Target Company by IDC Members	IDC Members have confirmed that they have not traded in the Equity Shares of the Target Company from the date of the Public Announcement till the date of this Recommendations.		
IDC Member's relationship with the Acquirer (Director, Equity shares owned, any other contract/ relationship), if any.	None of the IDC Members hold any contract, nor have any direct or indirect relationship with the Acquirer, their promoter, directors, and shareholders, in their personal capacities.		
Trading in the equity shares/other securities of the acquirers by IDC Members	IDC Members have confirmed that they have not traded in the equity shares of the Acquirer.		
Recommendation on the Open offer, as to whether the offer, is or is not, fair, and reasonable	Based on the review of the Offer Documents issued by the Manager to the Offer on behalf of the Acquirer, IDC Members believe that the Offer is fair and reasonable and in line with the SEBI (SAST) Regulations. The shareholders may independently evaluate the Offer, the market performance of the Equity Shares, and take an informed decision in the best of their interests. Further, the Public Shareholders, should independently review the Letter of Offer dated Friday, August 08, 2025, including the risk factors described therein before taking any decision in relation to this Offer.		
Summary of reasons for the recommendation	IDC Members have taken into consideration and reviewed the following Offer Documents for making the recommendation: a) The Public Announcement dated Thursday, May 22, 2025 (Public Announcement'): b) Detailed Public Statement dated Wednesday, May 28, 2025, in connection with this Office published on behalf of the Acquirer on Thursday, May 29, 2025, Financial Express (English daily) (All Editions), Jansatta (Hindi daily) (All Editions), and Mumbai Lakshades (Marathi Daily) (Mumbai Edition), and Prajavani (Kannada Daily) (Bangalore Edition) (*Detailed Public Statement'): c) Draft Letter of Offer dated Thursday, June 05, 2025, filed and submitted with SEBI pursuant the provisions of Regulation 16 (1) of the SEBI (SAST) Regulations (*Draft Letter of Offer*) d) The Letter of Offer along with Form of Acceptance and Form SH-4 dated Friday, August 0 2025 (*Letter of Offer*); The Offer Price is in terms of Regulation 8(2) of the SEBI (SAST) Regulations. Based on the review of the aforesaid Offer Documents, the IDC Members are of the view the Offer Price is in line with the parameters prescribed by SEBI in the SEBI (SAST) Regulation.		
Disclosure of Voting Pattern	These recommendations have been unanimously approved by the IDC Members		
Details of Independent Advisors, if any	None		
CONTRACTOR OF THE CONTRACTOR O	- CANAL		

ई-नीलामी बिक्री सूचना (आईबीबीआई (परिसमापन प्रक्रिया) विनियम, 2016 के विनियम 32 और 33 के अंतर्गत) फ्यूचर रिटेल लिमिटेड (परिसमापन में)

For and on behalf of the Committee of Independent Directors

M/s SER Industries Limited

Mr. Om Narayan Singh Chairman of the IDC

(DIN: 10320343)

नीलामी की तिथि और समय: 1 सितंबर, 2025, दोपहर 03 बजे से शाम 05 बजे तक

To the best of our knowledge and belief, after making the proper enquiry, the information contained in or accompanying this statement is, in all

material respect, true and correct and not misleading, whether by omission of any information or otherwise, and includes all the information

required to be disclosed by the Target Company under the Regulations.

Place: Bangalore

Date: Thursday, August 14, 2025

फ्यूचर रिटेल लिमिटेड ("एफआरएल") के परिसमापक एतदुद्वारा पात्र बोलीदाताओं को एफआरएल के संपत्ति की ई-नीलामी बिक्री में भाग लेने के लिए आमंत्रित करते हैं, जिसे यहां "जैसा है जहां है", "जैसा है जो भी है" और "बिना किसी सहारा" के आधार पर सूचीबद्ध किया गया है. विस्तत नियम. शर्तें और प्रक्रिया बोली दस्तावेज में उल्लिखित हैं जिसे https://ibbi.baanknet.com/ से डाउनलोड किया जा सकता है या frl.eauction@gmail.com पर ईमेल भेजकर प्राप्त किया जा सकता है.

लॉट नं.	संपत्ति	मात्रा	स्थान	आरक्षित मूल्य (आईएनआर)	ईएमडी (आईएनआर)
31	पीपीई-फर्नीचर का स्क्रैप और स्क्रैप अथवा क्षतिग्रस्त स्थिति में विविध सामग्री	लम्पसम	ईज़ी डे स्टोर, टिकरी, नई दिल्ली	2,33,814	23,381
		नीलामी समयर	नारिणी :		

नालामा समयसारिणाः				
अ.क्र.	घटना विवरण	तिथि		
1	नीलामी विज्ञापन जारी होना	18 अगस्त, 2025		
2	बोलीदाता द्वारा नीलामी के तहत संपत्तियों का निरीक्षण करने का समय	28 अगस्त, 2025 तक		
	संभावित बोलीदाता द्वारा ईएमडी तथा बोली दस्तावेज और 29ए पात्रता प्रतिज्ञापत्र सहित अन्य दस्तावेज जमा करने की अंतिम तिथि	29 अगस्त 2025		
4	ई-नीलामी की तिथि	01 सितंबर, 2025		

*कर, शुल्क, लेवी, प्रभार, ड्यूटीज हस्तांतरण शुल्क, स्टांप शुल्क, पंजीकरण शुल्क, प्रीमियम आदि को छोड़कर. वारंटी और क्षतिपूर्ति के संबंध में कोई प्रतिनिधित्व नहीं किया जाएगा.

मह्त्वपूर्ण टिप्पणियां :

दिनांक: 18 अगस्त, 2025

स्थान : नई दिल्ली

1. संपत्तियों की बिक्री ई-नीलामी के माध्यम से सख्ती से "जैसा है जहां है", "जैसा है जो भी है" "जो भी वहां है " और "बिना किसी सहारा" के आधार पर आवश्यक रूप से आयोजित की जाएगी.

- 2. बिक्री, दिवाला एवं शोधन अक्षमता संहिता 2016 तथा उसके अंतर्गत निर्मित परिसमापन विनियमों के प्रावधानों के अधीन होगी. नीलामी तिथि से पर्व. सीडी (फ्यचर रिटेल लिमिटेड) की किसी भी देयता के संबंध में सभी दावों को तदनसार निपटाया जाएगा. नीलामी तिथि के पश्चात नीलामी अंतर्गत संपत्तियों के संबंध में सभी दावों/देयताओं की एकमात्र जिम्मेदारी सफल
- 3. पुर्ण ई-नीलामी प्रक्रिया दस्तावेज में संपत्तियों का विवरण, ऑनलाइन ई-नीलामी बिड फॉर्म, घोषणापत्र और प्रतिज्ञापत्र फॉर्म, सामान्य नियम और शर्तें शामिल हैं जो वेबसाइट https://ibbi.baanknet.com/ पर उपलब्ध हैं.
- 4. संभावित बोलीदाताओं को अपने ई-वॉलेट खाते के माध्यम से https://ibbi.baanknet.com/ पोर्टल पर बयाना राशि जमा (ईएमडी) करनी होगी.
- 5. ई-नीलामी प्रक्रिया के बंद होने पर सबसे अधिक बोली राशि वाले को हितधारकों की परामर्श समिति के साथ परामर्श पश्चात
- सफल बोलीदाता घोषित किया जाएगा और इस संबंध में इलेक्ट्रॉनिक माध्यम के जरिए एक संचार जारी किया जाएगा. 6. संहिता की धारा 35(1)(एफ) के प्रावधानों के अनुसार, इच्छुक बोलीदाता यदि संहिता की धारा 29ए (समय-समय पर
- संशोधित अनुसार) में निर्दिष्ट अनुसार पात्रता मापदंड की पूर्ति में विफल रहते हैं तो वे बोली जमा करने हेतु पात्र नहीं होंगे.
- 7. सफल बोलीदाता का ईएमडी आंशिक बिक्री मुल्य के रूप में रखा जाएगा और असफल बोलीदाताओं के ईएमडी ब्याज, बैंक
- शुल्क या किसी अन्य शुल्क के बिना वापस कर दिए जाएंगे. ईएमडी पर कोई ब्याज नहीं मिलेगा. 8. इच्छुक आवेदकों को खरीदार के तौर पर पोर्टल पर लॉगिन करके https://ibbi.baanknet.com/ पर ईएमडी राशि
- जमा करना और आवश्यक दस्तावेज जमा करना आवश्यक है. साथ ही, उन्हें इसी पोर्टल पर पात्रता दस्तावेज भी जमा करने
- 9. संभावित बोलीदाताओं को यह प्रतिज्ञापत्र प्रस्तृत करना होगा कि वे संहिता की धारा 29ए में वर्णित किसी भी अपात्रता से
- पीडित नहीं हैं, और यदि वे अपात्र पाए जाते हैं, तो पहले से जमा की गई ईएमडी जब्त कर ली जाएगी. 10. सफल नीलामी बोलीदाता को परिसमापक द्वारा आशय पत्र जारी होने के 30 दिनों के भीतर शेष बिक्री राशि का भुगतान

करना होगा. 30 दिनों के बाद और 90 दिनों से पहले के भूगतान पर 12% की दर से ब्याज लगेगा. यदि आशय पत्र की तिथि से 90 दिनों के भीतर भूगतान प्राप्त नहीं होता है तो बिक्री रद्द कर दी जाएगी.

> IBBI रजि. नं. : IBBI/IPA-002/IP-00982-C01/2017-2018/10354 लिक्विडेटर - फ्यूचर रिटेल लिमिटेड

पंजीकृत ईमेल : sanjay@sgaindia.in

पत्राचार ईमेल : frl.eauction@gmail.com

पताः प्राइमस इंसोल्वेंसी रिजॉल्युशन एंड वैल्युएशन प्रा. लि. डी-58, डिफेंस कॉलोनी, 3री मंजिल, नई दिल्ली - 110024

मोबाइल नं. 9540016852

हस्ता/-

संजय गुप्ता

epaper.jansatta.com

૧૮ - ઓગસ્ટ - ૨૦૨૫ - સોમવાર 18 - AUGUST - 2025 - MONDAY

RAJKOT

Mali Figure

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA. INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE SME PLATFORM OF BSE LIMITED ("BSE SME") IN COMPLIANCE WITH CHAPTER IX OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS").

PUBLIC ANNOUNCEMENT





GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED

Our Company was originally incorporated as a Private Limited Company in the name of "Gujarat Peanut Products Private Limited" on October 14, 2005 under the provisions of Companies Act, 1956 bearing Corporate Identification Number U15490GJ2005PTC046918 issued by Registrar of Companies - Gujarat, Dadra and Nagar Haveli. Subsequently, our company was converted into Public Limited Company under the Companies Act, 2013 and the name of our Company was changed to "Gujarat Peanut Products Limited" vide a fresh Certificate of Incorporation consequent upon conversion from Private Company to Public Company dated June 26, 2024 bearing Corporate Identification Number U15490GJ2005PLC046918 issued by Registrar of Companies – Gujarat. The name of our Company was further changed to "Gujarat Peanut and Agri Products Limited" vide a fresh Certificate of Incorporation dated November 12, 2024 issued by the Registrar of Companies, Central Processing Centre. For further details of change in name and registered office of our company, please refer to section titled "Our History and Certain Corporate Matters" beginning on page no 139 of the Draft Prospectus.

> Registered Office: D - 402, Imperial Heights, Opp. Big Bazar, 150 Feet Ring Road, Rajkot, Gujarat, India, 360005 Contact Person: Mr. Jeetkumar B. Raychura, Company Secretary & Compliance Officer; Tel No: +91 98258 03208; E-Mail ID: cs@gujaratpeanut.com; Website: www.gujaratpeanut.com; CIN: U15490GJ2005PLC046918

OUR PROMOTERS: (I) MR. ARUNKUMAR NATVARLAL CHAG, (II) MR. SAGAR ARUNKUMAR CHAG AND (III) MRS. DHRUVA SAGAR CHAG

INITIAL PUBLIC OFFER OF 29,76,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH ("EQUITY SHARES") OF GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, INCLUDING A SHARE PREMIUM OF ₹70/- PER EQUITY SHARE (THE "ISSUE PRICE"), AGGREGATING TO ₹ 2,380.80 LAKHS ("THE ISSUE"), OF WHICH 1,48,800 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 119.04 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTIONS BY THE MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS MARKET MAKER RESERVATION PORTION I.E. ISSUE OF 28,27,200 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH FOR CASH AT A PRICE OF ₹80/- PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 2,261.76 LAKHS IS HERE IN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 29.00% AND 27.55% RESPECTIVELY OF THE POST ISSUE PAIDUP EQUITY SHARE CAPITAL OF THE COMPANY.

THE FACE VALUE OF THE EQUITY SHARE IS ₹ 10/- EACH. THE OFFER PRICE IS 8.0 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES.

THIS OFFER IS BEING MADE IN TERMS OF CHAPTER IX OF THE SEBI (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIRMENT) REGULATIONS, 2018 (THE "SEBI ICDR REGULATIONS") READ WITH RULE 19(2)(b)(i) OF SCRR AS AMENDED. THIS ISSUE IS A FIXED PRICE ISSUE AND ALLOCATION IN THE NET OFFER TO THE PUBLIC WILL BE MADE IN TERMS OF REGULATION 253(2) OF THE SEBI (ICDR) REGULATIONS, 2018. (For further details please see "The Issue" beginning on page no. 46 of the Draft Prospectus.) A copy will be delivered for filing to the Registrar of Companies as required under sub-section 4 of Section

In terms of Regulation 256 of SEBI ICDR Regulations read with the SEBI Circular No. CIR/CFD/POLICYCELL/11/2015 dated November 10, 2015, and Unified Payments Interface (UPI) introduced vide SEBI Circular Ref: SEBI/HO/CFD/DIL2/CIR/P/2018/138 dated November 1, 2018 all the potential investors shall participate in the issue only through an Application Supported by Blocked Amount ("ASBA") process providing details about the bank account which will be blocked by the Self Certified Syndicate Banks ("SCSBs") for the same. Further, pursuant to SEBI Circular No. SEBI/HO/CFD/DCR2/CIR/P/2019/133 dated November 08, 2019, Individual Investors applying in public issue may use either Application Supported by Blocked Amount (ASBA) process or UPI payment mechanism by providing UPI ID in the Application Form which is linked from Bank Account of the investor. (For details in this regard, specific attention is invited to "Issue Procedure" beginning on page no. 261 of the Draft Prospectus.)

This public announcement is being made in compliance with the provisions of Regulation 247(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares pursuant to the Offer and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited (BSE SME). Pursuant to Regulation 247(1) of the SEBI ICDR Regulations, the Draft Prospectus filed with BSE SME shall be made public for comments, if any, for a period of at least 21 days, from the date of such filing by hosting it on the website of BSE SME at www.bseindia.com, on the website of the Company at www.gujaratpeanut.com and on the website of the Lead Manager, i.e. Finshore Management Services Limited at www.finshoregroup.com. Our Company invites members of the public to give their comments on the Draft Prospectus filed with BSE SME, with respect to disclosures made in the Draft Prospectus. The members of the public are requested to send a copy of their comments to BSE and/or to the Company Secretary and Compliance Officer of our Company on email id: cs@gujaratpeanut.com and/or the Lead Manager on email id: investors@finshoregroup.com within 21 days from the aforesaid date of filing of the Draft Prospectus with BSE SME.

Investments in Equity and Equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Equity Shares issued in the Issue have not been recommended or approved by the Securities and Exchange Board of India ("SEBI"), nor does SEBI guarantee the accuracy or adequacy of the Draft Prospectus. Specific attention of the investors is invited to the section "Risk Factors" beginning on page 22 of the Draft Prospectus.

Any decision to invest in the Equity Shares described in the Draft Prospectus may only be taken after the Prospectus has been filed with the RoC and must be made solely on the basis of such Prospectus as there may be material changes in the Prospectus from the Draft Prospectus. The Equity Shares, when offered through the Prospectus, are proposed to be listed on the SME Platform of BSE Limited ("BSE SME").

For details of the share capital and capital structure and the names of the Signatories to the Memorandum of Association and the number of shares subscribed by them of our Company, please see the section titled "Capital Structure" beginning on page 59 of the Draft Prospectus. The liability of members of our Company is

For details of the main objects of our Company as contained in the Memorandum of Association, please see the section titled "History and Certain Corporate Matters" beginning on page 139 of the Draft Prospectus.

LEAD MANAGER TO THE ISSUE

FINSHORE Creating Enterprise Managing Values

FINSHORE MANAGEMENT SERVICES LIMITED

Anandlok Building, Block-A, 2nd Floor, Room No. 207, 227 A.J.C Bose Road, Kolkata-700020, West Bengal, India

Telephone: 033 - 2289 5101 / 4603 2561 Email: info@finshoregroup.com

Contact Person: Mr. S. Ramakrishna Iyengar

Website: www.finshoregroup.com Investor Grievance Email: investors@finshoregroup.com

SEBI Registration No: INM000012185 CIN No: U74900WB2011PLC169377

REGISTRAR TO THE ISSUE

Integrated

INTEGRATED REGISTRY MANAGEMENT SERVICES (P) LIMITED

Sampige Road, Malleswaram, Bengaluru - 560003

Telephone: 080-23460815/816/817/818; Fax: 080-23460819 E-mail: smeipo@integratedindia.in

Contact Person: Mr. S Giridhar

Website: www.integratedregistry.in Investor Grievance Email: giri@integratedindia.in

SEBI Registration No: INR000000544 CIN No: U74900TN2015PTC101466

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed in the Draft prospectus.

For GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED On behalf of the Board of Directors

> Sagar Arunkumar Chag **Managing Director**

Place: Rajkot, Gujarat Date: 16/08/2025 DIN: 02192020

GUJARAT PEANUT AND AGRI PRODUCTS LIMITED is proposing, subject to the receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the Draft Prospectus on August 14, 2025 with SME Platform of BSE Limited ("BSE SME"). The Draft Prospectus is available on the websites of the BSE SME at www.bseindia.com, the website of the Company at www.gujaratpeanut.com and the website of the Lead Manager, i.e., Finshore Management Services Limited at www.finshoregroup.com. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section titled 'Risk Factors" on page 22 of the Draft Prospectus. Potential investors should not rely on the Draft Prospectus filed with BSE SME for making any investment decision.

This announcement has been prepared for publication in India and not to be released or distributed in the United States. This announcement is not an offer to sell or a solicitation of any offer to buy Equity Shares of our Company in any jurisdiction, including the United States. The Equity Shares have not been, and will not be, registered under the U.S. Securities Act 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States and may not be Issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in Regulation S under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act. Accordingly, the Equity Shares will be Issued and sold outside the United States in compliance with Regulation S of the Securities Act and the applicable laws of the jurisdiction where those Issues and sales occur. The Equity Shares have not been, and will not be, registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be Issued or sold, and applications may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.

ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી બદલ નવી સિવિલ હોસ્પિટલના

તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારને **જિલ્લा કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા**

પલસાણા તાલુકાના એના ગામે સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વમાં બહુમાન



તબીબી અધિક્ષક ડો. ધારિત્રી કામગીરી બદલ પલસાણા તાલુકાના એના ગામે સ્વાતંત્ર?ય પર્વની ઉજવણી ડો.સૌરભ પારધીના હસ્તે

જનાદેશ પ્રતિનિધિ, સુરત સન્માનિત કરવામાં આવ્યા સિવિલ થકી આજ સુધી ૭૫ આપવામાં આવ્યો હતો. નવી નવું જીવન મળે છે.

: નવી સિવિલ હોલ્ખિટલના હતા. નોંધનીય છે કે, ભારત અંગદાન થઇ ચુક્યા છે. સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે બ્રેઇનડેડ થવાના કિસ્સામાં પરમારને અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ તરફથી સુરત નવી સિવિલ મહત્તમ અંગદાન થાય એવા હોલ્ખિટલને ગત તા.રજી પ્રયાસો નવી સિવિલ તંત્ર દ્વારા ઓગસ્ટ-૨૦૨૫ના રોજ બેસ્ટ કરવામાં આવે છે, જેમાં નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અંગદાન થકી અંગોની પ્રસંગે જિલ્લા કલેક્ટર રિટ્રાયવલ સેન્ટરનો પુરસ્કાર જરૂરિયાત ધરાવતા દર્દીઓને

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ

ઝંખવાવ રેન્જમાં ફરજ બજાવતા વનરક્ષક હિતેશકુમાર भाजीने डर्भचारीने शिल्ला डलेड्टरना हस्ते सन्भानित

પલસાણા તાલુકાના એના ગામે સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વમાં બહુમાન



જનાદેશ પ્રતિનિધિ, સુરત : સ્વાતંત્ર?ય પર્વના અવસરે ઝંખવાવ રેન્જના વન વિભાગના કર્મચારી હિતેશકમાર માળીને વન્યજીવ રક્ષણ, વૃક્ષોના વાવેતર, ઉછેર અને જંગલ સંરક્ષણમાં તેમના છેલ્લાં આઠ વર્ષના અવિરત અને સમર્પિત યોગદાન બદલ પલસાણા તાલુકાના એના ગામે સ્વાતંત્ર?ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર

વાંકલ સુરત વન વિભાગમાં ફરજ નિભાવતા વનસંરક્ષક હિતેશકુમાર માળીએ કહ્યું હતું કે, સ્વાતંત્ર?ય પર્વ પર મળેલું સન્માન એ પ્રકૃતિના સંરક્ષણ માટેની સેવા ભાવનાનું સન્માન છે. વન્યજીવોની રક્ષા એ આપણે પોતાના કદરતી સાથે સમન્વય રાખીશું તો આઝાદી સુનિષ્ટિત થશે.

સન્માનિત કરવામાં આવ્યા લઇને નાની-મોટી અનેક અવિરતપણે કાર્યરત છે. હતા.વનરક્ષક ઝંખવાવ રેન્જ જાતિના પ્રાણીઓનું રેસ્ક્ય્,

સારવાર જંગલમાં મુક્તિ, માનવ વસાહતોમાં ઘૂસેલ દિપડાઓને 'હ્યુમન-એનિમલ કોનિશ્ચમક્ટ' પરિસ્થિતિઓમાં લોકોમાં જાગૃતિ, કૃત્રિમ અવાડાઓ (પાણીના હૌજ) બનાવવા, ૩ વારસાની રક્ષા છે. પ્રકૃતિ દિપડાનું કુવામાંથી રેસ્ક્યૂ, વૃક્ષારોપણ અને ઉછેર, પ્રાણી, પક્ષીઓ, વન્યજીવોની જંગલમાં ખેડાણ, લાકડાની તસ્કરી અને જંગલમાં આગ છેલ્લા આઠ વર્ષથી તેઓ જેવી ઘટનાઓ અટકાવવા ડો.સૌરભ પારધીના હસ્તે વન્યજીવોના રક્ષણ, દિપડાથી માટે સતત પેટ્રોલિંગ માટે

(સંકલનઃ મહેશ કથીરિયા)

પલસાણા તાલુકાના એના ગામે સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

જનાદેશ પ્રતિનિધિ, સુરત પલસા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ૧૫મી ઓગષ્ટ- ૭૯મા સ્વાતંત્રય પર્વની સુરત જિલ્લાકક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી-કર્મચારીઓ, નાગરિકો, ૧૦ બ્રેઇનડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ સ્વાતંત્રય પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકસિત

ગજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લો એક સમર્પિત ભાગીદારના રૂપમાં યોગદાન આપી રહ્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ ગામો, છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પીવાનું સ્વચ્છ પાણી, સિંચાઇનું પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળો પહોંચ્યા છે, આ વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે. દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઇ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ગુજરાત અને જિલ્લાનું ગૌરવ વધ્યું હોવાનું જણાવી આ સિદ્ધિ બદલ પદાધિકારી-અધિકારીઓ, ગ્રામજનો અભિનંદન આપ્યા હતા. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરત જિલ્લો અને શહેર સ્વચ્છતામાં દેશભરમાં

અગ્રેસર રહ્યા છે. દેશમાં સ્વચ્છ શહેરની નામના નગરપાલિકાએ ભારતના ટોચના ૧૦૦ સ્વચ્છ સુરતને મળી છે. શહેર સાથે નગરપાલિકાઓ પણ સ્વચ્છતામાં અગ્રેસર રહી છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ માં બારડોલી અને કડોદરા

શહેરમાં સ્થાન મેળવ્યું છે ગૌરવપ્રદ છે. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તા

મંડળો, જામનગર, ભાવનગર અને જુનાગઢ બિનખેતી કરવાની અરજદારની અરજીની તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર કલેક્ટરશ્રીએ કહ્યું હતું. અથવા નિયંત્રીત સત્તા પ્રકારની તમામ જમીનો રહેશે નહી.

વહીવટી અન્કુળતા તથા બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિમાં વધુ સરળીકરણના ભાગરૂપે બિનખેતીની પરવાનગી આપવા દરમિયાન ખેડુત ખરાઇ બાબતે મહેસુલી રેકર્ડના ચકાસણીના કિસ્સામાં

વિસ્તાર વિકાસ સત્તામંડળો સિવાયની રાજ્યના તારીખથી છેલ્લા ૨૫ વર્ષનું જ રેકર્ડ ધ્યાને લેવામાં આવશે એમ વિગતો આપતા

જનસહયોગથી સુરત જિલ્લો મહેસુલ વિભાગના ઠરાવથી જૂની શરતની પ્રગતિના પંથે હોવાનું જણાવી કલેક્ટરશ્રીએ ગણવામાં આવશે, જેનાથી આવી જમીનો માટે ઉમેર્યું કે, સુરત જિલ્લા પંચાયતે ગ્રીન અને તબદિલી કે બિનખેતી હેતુફેર (રિવાઇઝડ રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ માટે બિનખેતી) માટે પ્રિમિયમના હેતુ માટે ગ્રામપંચાયત કચેરીઓ પર સોલાર પેનલ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં, ઇન્સ્ટોલ કરી ગ્રામ પંચાયતોને સૌર ઉર્જાથી તેમજ કોઇ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું સજ્જ અને સ્વાવલંબી બનાવવા સરાહનીય પહેલ કરી છે. જળસંચય અભિયાન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં સરકારી ગ્રાંટ, નાણા પંચની ગ્રાંટ, ફંડ અને સહકારી સંસ્થાઓના સહયોગથી લગભગ ૬૦,૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લો પ્રથમ સ્થાન પર રહ્યો છે.